

Seat No. : \_\_\_\_\_

**MA-I-81**  
**April-2007**  
**Philosophy**  
**Paper – IV (Option-5)**  
**(The Yoga System of Patanjali)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 100**

સૂચના : દરેક પ્રશ્નના ગુણ સમાન છે.

1. યમ-નિયમો સમજાવી, તેનું નૈતિક મહત્વ સ્પષ્ટ કરો.

**અથવા**

સાંખ્ય અને યોગદર્શનનો સંબંધ સવિસ્તર ચર્ચો.

2. સમાપત્તિ એટલે શું ? તેના પ્રકારો સમજાવો.

**અથવા**

અષ્ટાંગ યોગની સવિસ્તર સમજૂતી આપો.

3. યોગ સ્વીકૃત પ્રમાણોની ચર્ચા કરો.

**અથવા**

પંચકલેશોના કાર્યો સમજાવી, તેના નિવારણના ઉપાયો સ્પષ્ટ કરો.

4. આધુનિક સમયમાં યોગની પ્રસ્તુતતા સમજાવો.

**અથવા**

સમીજ અને નિર્ભીજ સમાધિ વચ્ચેનો ભેદ સમજાવો.

5. ટૂંકનોંધ લખો : (કોઈપણ બે)

(1) ચિત્તવૃત્તિઓ

(2) યોગ સિદ્ધીઓ

(3) યોગમાં ઈશ્વર

(4) કૈવલ્ય

Seat No. : \_\_\_\_\_

**MA-I-81**  
**April-2007**  
**Philosophy**  
**Paper – IV (Option-5)**  
**(The Yoga System of Patanjali)**

**Time : 3 Hours]**

**[Max. Marks : 100**

**Instruction :** All questions carry equal marks.

1. Explain the Yama and Niyama and clarify its Moral importance.

**OR**

Explain in detail the Relation between Samkhya and Yoga.

2. What is Samapatti ? Explain its kinds.

**OR**

Explain the Astangayoga in detail.

3. Discuss praman's accepted by the Yoga-System.

**OR**

Explain the functions of Panch Kleshas and means of there removal.

4. Explain the relevance of Yoga in Modern Times.

**OR**

Explain the difference between Sabija and Nirbija Samadhi.

5. Write notes (any **two**) :

- (1) Chittavruties
- (2) Yoga Siddhis
- (3) God in Yoga
- (4) Kaivalya.